



સીટી ઓફ બ્રેમ્પટન માર્ચ 8 નાં રોજ પ્રોવિન્સના ગ્રે-લોકડાઉન લેવલમાં પ્રવેશ કરશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (માર્ચ 7, 2021) – સોમવાર, માર્ચ 8 નાં રોજ મળસ્કે 12:01 વાગ્યાથી અમલી બનીને, પીલ રીજીયનના ભાગ તરીકે બ્રેમ્પટન ગ્રે-લોકડાઉન લેવલમાં પ્રવેશીને ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયોના **COVID-19 રિસ્પોન્સ ફ્રેમવર્ક: ઓન્ટેરિયોને સુરક્ષિત અને ખુલ્લું રાખવાના** આદેશને અનુસરશે.

ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયોનું ગ્રે-લોકડાઉન લેવલ

આ પ્રોવિન્સના ગ્રે-લોકડાઉન લેવલમાં નીચેના સુરક્ષા ઉપાયો અને નિયંત્રણોનો સમાવેશ થાય છે:

આયોજીત જાહેર કાર્યક્રમો, સામાજિક હળવું-મળવું અને ધાર્મિક સેવાઓ, વિધિઓ અને ઉત્સવો

- કોઈ ઈનડોર જાહેર કાર્યક્રમો થશે નહિ અને સામાજિક હળવું-મળવું નહિ સિવાય કે એક જ ઘરના સભ્યો સાથે હો. વડીલો સહિત એકલી રહેતી વ્યક્તિ, અન્ય કોઈ વ્યક્તિ સાથે ઘનિષ્ટ સંપર્કમાં રહેવાનું વિચારી શકે;
- આઉટડોર જાહેર કાર્યક્રમો કે સામાજિક હળવા-મળવાની સીમા મહત્તમ 10 વ્યક્તિઓ સીધી કરવામાં આવી છે;
- લગ્ન સેવાઓ, અંતિમક્રિયા સેવાઓ અને ધાર્મિક સેવાઓ, વિધિઓ કે ઉત્સવો જ્યાં વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવી શકાતું હોય તેવા ઈનડોર આયોજનોમાં 10 જેટલા લોકો અથવા આઉટડોર આયોજનોમાં 10 લોકો હાજર રહી શકે છે.

ધંધાઓ

- રૂબરૂમાં ખરીદી કરવાનું આ ક્ષમતા સીમાઓ સાથે ઉપલબ્ધ રહેશે:
 - સુપરમાર્કેટ્સ અને અન્ય સ્ટોર્સ જેઓ મુખ્યત્વે ગ્રોસરીસ (કરિયાણું), કન્વેનિયન્સ સ્ટોર્સ, ફાર્મસીસ (દવાઓ) વેચે છે: 50 ટકા ક્ષમતા
 - અન્ય ધંધાં રિટેઇલ સ્ટોર્સ (જેમાં ડિસ્કાઉન્ટ અને બિગ બોક્સ રિટેઇલર્સ, લિકર સ્ટોર્સ, હાર્ડવેર સ્ટોર્સ, ગાર્ડન સ્ટોર્સ સામેલ છે): 25 ટકા ક્ષમતા
- રેસ્ટોરન્ટ્સ, બાર્સ, અને ખાણી-પીણીની સગવડો માત્ર ટેકઆઉટ, ડ્રાઈવ-થ્રુ અને ડિલિવરી પૂરી પાડી શકશે. ઈનડોર અને આઉટડોર ડાઈનિંગ સેવાઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે;
- હેર સલૂન્સ, બાર્બર શોપ્સ, નેઈલ સલૂન્સ અને ટેટૂ પાર્લર્સ સહિતની અંગત સંભાળ સેવાઓ બંધ રહેશે;
- કેસિનો, બિંગો હોલ્સ અને અન્ય ગેમ્સ એસ્ટાબ્લિશમેન્ટ્સ બંધ રહેશે;
- પૂલ્સ સહિતની, ઈનડોર સ્પોર્ટ્સ અને મનોરંજનલક્ષી (રિક્રિએશનલ) સગવડો, સીમિત અપવાદો સાથે બંધ રહેશે.
- ઘરેલું અને સફાઈ અને નિભાવ-જાળવણી સેવાઓની પરવાનગી આપવામાં આવે છે. ઈનડોર કે આઉટડોર પેઈન્ટિંગ, પૂલ સફાઈ, સામાન્ય સમારકામ સહિત, આઉટડોર સફાઈ અને નિભાવ-જાળવણી સેવાઓને પરવાનગી આપવામાં આવે છે.

સ્કૂલ્સ અને ચાઈલ્ડ કેર

- સ્કૂલ્સ, સ્કૂલ સમય પહેલાંના અને પછીના કાર્યક્રમો, અને બાળ સંભાળ ખુલ્લા રહેશે;
- પોસ્ટ-સેકન્ડરી સ્કૂલ્સ વર્ચ્યુઅલ શિક્ષણ માટે ખુલ્લી રહેશે જેમાં સીમિત અપવાદો સાથે માત્ર રૂબરૂમાં શિક્ષણ આપી શકાતી તાલીમ, ક્લિનિકલ તાલીમ કે ટ્રેડ સંબંધિત તાલીમ આપી શકાશે.

સીટી સર્વિસીસ અને ફેસિલિટીસ

સીટી હોલ અને કોર્પોરેટ સગવડો

સીટી હોલ અને કોર્પોરેટ સગવડો રૂબરૂ સેવાઓ માટે માત્ર એપોઈન્ટમેન્ટથી ખુલ્લી રહે છે. વૉક-ઇન્સને પરવાનગી આપવામાં આવી નથી.



એપોઈન્ટમેન્ટ બૂક કરાવવા, વેબસાઈટ જુઓ www.brampton.ca/skiptheline.

સીટી રિક્રિએશન સેન્ટર્સ

સીટી ઓફ બ્રેમ્પટનની બધી મનોરંજનલક્ષી સગવડો જાહેર જનતા માટે બંધ રહેશે અને ઈનડોર પ્રોગ્રામ્સ આગળ નોટિસ આપતા સુધી રદ રહેશે.

વર્યુઅલ પ્રોગ્રામ્સ

વર્યુઅલ ફિટનેસ

રહેવાસીઓને શિક્ષકની આગેવાનીમાં વર્યુઅલ ફિટનેસ વર્ગોમાં સહભાગી થવાનું નિમંત્રણ આપવામાં આવે છે. તાલીમબદ્ધ ફિટનેસ ઈન્સ્ટ્રક્ટર્સ સાથે 30-મિનિટના મફત લાઈવ વર્કઆઉટ્સ માર્ચ 15 નાં રોજ શરૂ થશે. નોંધણી માર્ચ 8 નાં રોજ ખુલે છે.

55+ વર્કશોપ્સ

55 વર્ષ અને વધારે ઉંમરના બ્રેમ્પટનવાસીઓ પોતાના ઘરેથી વર્યુઅલ વર્કશોપ્સ માટે મફતમાં નોંધણી કરાવી શકે છે. સહભાગીઓ પાસે સુરક્ષિત અને સંરચિત વાતાવરણમાં સોશિયલાઈઝ થવાની, નવા મિત્રો બનાવવાની અને ઓનલાઈન જોડાવાની તક રહેશે.

સર્વગ્રાહી વર્યુઅલ પ્રવૃત્તિઓ અને વર્કશોપ્સ

આ શ્રેણી અશક્તતા ધરાવતા અને અપવાદમય સહભાગીઓ માટે પ્રવૃત્તિઓમાં જોડાવાની, કંઈક નવું શીખવાની અને સમોવડિયાઓ સાથે સ્થાયી મિત્રતા બનાવવાની ચડિયાતી તક છે. નોંધણી કેવી રીતે કરવી તે સહિત, વર્યુઅલ પ્રોગ્રામ ઓફર્સ સંબંધમાં વધુ માહિતી

વેબસાઈટ www.brampton.ca/recreation પર ઓનલાઈન જોઈ શકાય છે.

રેક એટ હોમ (Rec At Home)

ઘરે બેઠાં સ્વ-માર્ગદર્શક ઓનલાઈન આટર્સ અને ક્રાફ્ટ ટ્યુટોરિયલ્સ સાથે સક્રિય અને પ્રવૃત્તમય રહો, 24/7 પહોંચ સુલભ! ઓરિગામી હાટર્સ બનાવવાની રીત શીખો, તમારી કેલિગ્રાફી આવડતો, અને ઘણાં બધાંનો મલાવરો કરો. વિવિધ રેક એટ હોમ પ્રવૃત્તિઓમાં [અહીંથી](#) પ્રવેશો, તેને બ્રેમ્પટન રિક્રિએશને પ્રેમપૂર્વક બનાવી છે.

બ્રેમ્પટન લાઈબ્રેરી

બ્રેમ્પટન લાઈબ્રેરી ચિંગકુસી, ફોર કોર્નર્સ, અને સિંગ્રંગડેલ શાખા પુસ્તકાલયોમાં સીમિત બ્રાંચ સેવાઓ આપશે. તા. માર્ચ 15, 2021 થી આ સ્થળોએ કર્બસાઈડ પિકઅપ બંધ કરવામાં આવશે. સીરિલ ક્લાર્ક, ગોર મીડોસ, માઉન્ટ પ્લેઝન્ટ વિલેજ, સાઉથ ફ્લેયર્સ અને સાઉથ વેસ્ટ શાખા પુસ્તકાલયોમાં મૂકી રાખેલા પુસ્તકો (હેલ્ડ મટીરિયલ્સ)નું કર્બસાઈડ પિકઅપ ચાલુ રહેશે. બધાં લાઈબ્રેરી સ્થળોએ ગ્રાહકો લાઈબ્રેરી મટીરિયલ્સની ગ્રેબ એન્ડ ગો (Grab'n' Go) બેગ્સ ઉછીની લઈ શકે છે અને મટીરિયલ્સ 24-કલાક બ્રાંચ બહારના ડ્રોપ બોકસીસમાં સુરક્ષિત રીતે અને સહેલાઈથી પરત કરી શકે છે. ઓવરડ્યુ દંડ આગળ નોટિસ આપતા સુધી વસૂલવામાં આવશે નહીં.

આ સમયે બ્રાંચ સેવાઓમાં માત્ર હોલ્ડર્સ પિકઅપ, લેવડદેવડ હેતુસર લાઈબ્રેરી કોમ્પ્યુટર્સનો સીમિત ઉપયોગ, પ્રિન્ટિંગ, અને ફોટોકોપી સેવાઓનો સમાવેશ થાય છે. આ સમયે બ્રાંચમાં અભ્યાસ માટે જગ્યા (સ્ટડી સ્પેસ) ઉપલબ્ધ નથી અને કામ કે અભ્યાસ કરવા અંગત સાધનોનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. સંચાલનના ક્લાકો, સુરક્ષા પ્રોટોકોલ્સ, અને પુસ્તકો કેવી રીતે રાખી મુકવા (હાઉ ટૂ પ્લેસ હોલ્ડર્સ) માટે [અહીં ક્લિક કરો](#).

મેન્ડેટરી ફેસ કવરિંગ્સ



મેન્ટેટરી ફેસ કવરિંગ્સ બાય-લો હેઠળ, બ્રેમ્પટનમાં બધી ઈનડોર જાહેર જગ્યાઓમાં નોન-મેડિકલ મારક્સ કે ફેસ કવરિંગ્સ પહેરવા અનિવાર્ય છે. જાહેર સંસ્થાઓ અને ધંધાઓએ પોતાના નિયંત્રણ હેઠળની ઈનડોર જાહેર જગ્યાઓમાં મારક્સ કે ફેસ કવરિંગ્સ પહેર્યા હોવાની ખાતરી કરવી અનિવાર્ય છે.

આ બાય-લો (પેટા-કાનૂન) મુક્તિ આપે છે, તબીબી કારણોસર માર્ક કે ફેસ કવરિંગ ના પહેરી શકતી વ્યક્તિઓ સહિતની ચોક્કસ વ્યક્તિઓને; બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને; કટોકટી હુકમો અનુસાર અથલેટિક (કસરતી) પ્રવૃત્તિઓમાં પ્રવૃત્તમય લોકોને. વધુ માહિતી માટે વેબસાઇટ જુઓ: www.brampton.ca/masks

રહેવાસીઓ અને ધંધાઓ વધુ માહિતી અને સર્વિસ વિનંતીઓ માટે 311 નંબર પર કૉલ કરી શકે છે, વેબસાઇટ www.311brampton.ca જોઈ શકે છે અથવા 311 મોબાઇલ ઓપનો ઉપયોગ કરી શકે છે.

લિંક્સ (કડીઓ)

વધુ માહિતી મેળવો:

- [સીટી ઓફ બ્રેમ્પટન COVID-19 પ્રોગ્રામિંગ અને સર્વિસ અપડેટ્સ](#)
- [સીટી ઓફ બ્રેમ્પટન – શું ખુલ્લું છે, શું બંધ છે](#)
- [COVID-19 લક્ષણો](#)
- [COVID-19 વેક્સીન \(રસી\)](#)
- [બ્રેમ્પટનમાં ટેસ્ટિંગ](#)
- [સેલ્ફ-આઈસોલેટ કેવી રીતે થવું](#)
- [COVID-19 દરમિયાન ધંધાઓ અને કાર્યસ્થળોને સુરક્ષિત રાખવા](#)
- [પીલમાં COVID-19 નાં કેસીસ](#)

-30-

મિડિયા સંપર્ક :

મોનિકા દુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca